

ગોરા ધામ



સંકલન
શ્રી ગોર

શ્રી ગોર ધામ
મુ. નવા દ્રુવા, તા. વાકાનેર
જ. રાજકોટ (ગુજરાત)



જે નક્કી આવવાનું જ છે (જેમકે - દુઃખ, મોત) એનો ભય
નકામો અને જે નક્કી જાવાનું જ છે (જેમકે - સુખ, શરીર, માન)
એની લાલચ નકામી છે.



સંસાર પર આપણો જરા જેટલોય અધિકાર નથી, અને
સંસારનો આપણા પર જરા જેટલોય અધિકાર નથી.

ઈશ્વર પર આપણો પૂરેપૂરો અધિકાર છે અને ઈશ્વરનો આપણા
પર પૂરેપૂરો અધિકાર છે.



સૃજ માત્ર વિષયી પ્રાણીઓ માટે છે. વિષયી પ્રાણી જિજાસુ કે
ભક્ત થઈ શકતો નથી. એ તપ કરી શકે, પૂછ્ય કરી શકે, દાન કરી
શકે, - પણ પ્રેમ કરી શકતો નથી.



સ્વયંથી જન્મેલું, સ્વયંથી પોખાયેલું અને સ્વયં દવારા
સ્વયં પ્રતિ કરેલું પાપ દુર્બુધ્ય મનુષ્યને એવી રીતે નાટ કરે છે
જેવી રીતે પત્થરથી બનેલ પ્રજમણિા પત્થરને કાપે છે.

- ભગવાન બુદ્ધ



સૃષ્ટિ માત્ર વિષયી પ્રાણીઓ માટે છે. વિષયી પ્રાણી જિજાસુ કે
ભક્ત થઈ શકતો નથી. એ તપ કરી શકે, પૂણ્ય કરી શકે, દાન
કરી શકે, - પણ પ્રેમ કરી શકતો નથી.



સ્વયંથી જન્મેલું, સ્વયંથી પોખાયેલું અને સ્વયં દ્વારા સ્વયં પ્રતિ
કરેલું પાપ દુર્બુદ્ધિ મનુષ્યને એવી રીતે નષ્ટ કરે છે જેવી રીતે
પત્થરથી બનેલ પ્રજમણી પત્થરને કાપે છે.

-ભગવાન બુદ્ધ



પ્રેમમાં કોઈ પરાધીન નથી, અને મોહમાં કોઈ સ્વાધીન નથી.

કયારેય પણ ખિત્ર-ઉદાસ થઈને ન બેસો કારણાકે એના
થી કામ વધે છે.

માનહાનિનો ભય અભિમાન સૂચવે છે. ઘન આદિ
પદાર્થોની હાનિનો ભય આપણો લોભ સૂચવે છે. પ્રિય સ્વજનોથી
સંબંધ-વિચ્છેદનો ભય મોહ સૂચવે છે. મૃત્યુનો ભય દેહાસકિ ત
સૂચવે છે.

જ્યાં સુધી પ્રતિષ્ઠાનો ભય (બીજા આપણાને શું કહેશે
એવો ભય) છે, ત્યાં સુધી અવશ્ય માનજો કે તમે કર્તવ્ય પાલન
અને વ્યાહ્વાર-નીતિ માં આગસુ અને પ્રમાદી છો. પરલોકનો ભય

પૂણયની કમી સુચવે છે. પરલોકનો ભય પૂણયની કમી સુચવે છે.

જ્યાં સુધી નર્કનો ભય છે ત્યાં સુધી આપણો અપરાધી જ છીએ.

ભગવાન, સંત કે ગુરુનો ભય દ્વી વી સંપદા અધુરી છે એમ સુચવે છે.

શારીરિક કષ્ટનો ભય આપણી આળસ સુચવે છે. માનસીક દુઃખનો ભય એ સુચવે કે આપણો માની લીધેલા સુખનાં રાગી છીએ.

ભોગમાં રોગનો ભય છે, ધનમાં રાજ્યસત્તાનો ભય છે,
માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, ઝુપમાં
ઘડપણનો ભય છે, શાસ્ત્રજ્ઞાનમાં વાદ-વિવાદ નો ભય છે, ગુણમાં
દુષ્ટનો ભય છે, અને શારીરમાં મૃત્યુનો ભય છે.

મિથ્યાલિમાન (Vanity) થી ભેટ અને ભેટ થી કામ
જગ્મે છે.



ખુદને છોડીને કાંઈ પણ મેળવવાનો પ્રયાસ અધર્મ છે.
આપણે સ્વયંને પામી શકીએ - અન્ય કાંઈ પણ નહીં.



જેને જાણીએ છીએ અને ન માનીએ તો આપણે
અસત્સંગી છીએ.



સાધનામાં વિદ્યન જીવે છે

કારણક-

- (૧) અસંભવને સંભવ બનાવવાનો પ્રયાસ અટકતો નથી.
- (૨) સાધના જનિતું ન હોય એવા સુખોમાં લોહુપતા છે.
- (૩) જેનાથી લેણ છે એનાથી સંબંધ નથી તુટતો અને જેનાથી દુરી છે એની કાઢણા નથી છુટતી.
- (૪) જેનો ત્યાગ શક્ય નથી એની સેવા નથી થતી.



જે કર્મથી દ્રોષ વધે એ પાપ છે. પ્રત લેવું અને છોડી દેવું એ પાપ છે. મોદ્દુલી સેવામાં મનમાની કરવી એ પાપ છે. માતા-

પિતા અને ગુરુસામે વિવાદ કરવો એ પાપ છે.

સુખદ વસ્તુ માટે જયાં-ત્યાં દોડવાનું બંધ થશે ત્યારે જ
રાગ-દ્રેષ્ટ ઘટશે.

દુઃખ એકલા ભોગવી લેવાથી પાપ કપાય છે

જો અપને સે કભી દુર નહીં હોતા,
ઉસીસે પૂર્ણ પ્રેમ હો શકતા હૈ ।

અન્યનાં રૂપ સાથે મળીને અન્યનાં રૂપને પોતાનું રૂપ
માનવા લાગવું એ અંહ કારનો ધર્મ છે.



પોતાની દુર્વાસનાનું દમન કરવું અને ઉભરાઈ જવા ન
દેવી એ જ સદાચાર છે.



આત્માનું એક નામ મૃત્યુ છે !



જ્યાં સુધી પોતાનું હિત શેમાં છે એનો પૂર્ણતા બોધ

નથી, ત્યાં સુધી અન્યનું અહિત શેમાં છે એન્હી પુરેપુરી ખબર
પડતી નથી.

— ■ — ■ —
સદગુરનાં દેહનું સામીચ્ય નહીં - સદગુરની કૃપા કલ્યાણ
કરે છે.

— ■ — ■ —
પ્રાણ-શક્તિ માટે હઠ યોગ, મનઃ શક્તિ માટે જપ યોગ કે
ધ્યાન યોગ, કિયા-શક્તિ માટે કર્મ-યોગ, ભાવદ્વા-શક્તિ માટે
ભક્તિ-યોગ અને બુદ્ધિ શક્તિ માટે જ્ઞાન-યોગ છે.

ચિત્તમાં મોગુણા વધારે હોય તો ભુઢ્ટા, તમોગુણા પતા
રજોગુણા હોય તો ક્ષિપ્તતા, રજોગુણા વધારે હોય તો પિક્ષિપ્તતા,
સત્ત્વગુણા વધારે હોય તો એકાગ્રતા અને ચિત્ત નિર્ગુણા હોય તો
ચિત્ત નિરોધ હોય.

अपने अनुभवको प्रमाण मानने वाले सत्यके अधिकारी
नहीं है । वे कर्मके अधिकारी है, उपासना के अधिकारी है ।
जो अपने अनुभव पर संशय करता है वही जीजासु है । अपनी

अनुभूति पर संशय होना बहुत कठीन है । मुढ़, विषयी और
पामरको अपनी अनुभूति सच्ची लगती है ।

आसक्ति नुँ इन पराधीनता, क्षोभनुँ इन अशांति अने
क्षेध नुँ इन अप्रसन्नता छे.

देवपूजा, गुरु भक्ति, शास्त्रध्ययन, संयम अव्यास, तप
अने दान - आ छ नित्यकर्म-उत्तिनां साधन छे.

लोभथी छूटवा वस्तुने पोतानी न मानवी. मोहथी छूटवा

સંબંધીત વ્યક્તિને પોતાની ન માનવી. અભિમાનથી છુટવા।

અધિકારને પોતાનો ન માનવો.



જ્ઞાન સ્વરૂપ ગુરુની કૃપા વીનાં પ્રેમનો ઉપયોગ સત્ય માટે
થતો નથી. પ્રેમનો દુરુપયોગ કરવાવાળી વ્યક્તિ જોઈ, ઈર્ખાળુ,
પરનિંદક, હિંસક, કુરકમી અને અંધવિશ્વાસી બને છે. આ બધા
પ્રેમની વિરુદ્ધ પાપુકર્મે છે.

જેનો અનેક પર વિશ્વાસ છે, અનેકથી સંબંધ છે તે પ્રમ
નથી કરી શકતા તે તો મનની ઝચિપૂર્ણ તંનાં લોભી છે.

प्रेमविहीन ज्ञानथी जडता आवे छे. अने ज्ञानहीन

प्रेमथी भोह तथा कामुकता वधे छे.

अनुभूति जगतनां सौ कोईनी एकज होय छे. ज्याकै विचार कोई
पण बे व्यक्तिनां एक नथी होता.



पहेले अपनेको उचितमै लगाये । बादमै दुसरो को
उपदेश दे । इस तरह पंडित कलेशको प्राप्त नह री होगा ।

-धम्म-पद-



કુરાનમાં સરસ વાત છે:

અજ્ઞાનીનું સત્ય, વધુમાં વધુ, સામાન્ય નિયમ તરીકે,
સત્તાર થી અઢાર વર્ષ જીવતું રહે.



ગમે તેટલી વિપત્તિઓ પડે તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક
કુળની ઈચ્છા કરવી ચોગ્ય નથી. સાંસારિક ફળ માટે દૈવને
ભજવા, પ્રેમ માટે પ્રભુને ભજવા, અને મોક્ષ માટે ગુ રૂને ભજવા.



સત્યનું વાસ્તવિક સ્વરૂપ કોઈ પણ ગુણ અને એક પણ
દોષ ન રહે ત્યારે પ્રગટે છે.

સત્યની આવશ્યકતા શું છે ?

સ્થાયી પ્રસત્તતા અને પૂર્ગતા માટે. આ બે ચીજ સંસાર થકી
મળતી નથી. તેથી સત્યની આવશ્યકતા છે.

સત્યની પ્રાપ્તિનાં સાધન શું છે ?

એકવાર જે ભાવ પેદા થાય એ ભાવ સદા રહે અનાથી
ઉલટો ભાવ કદિ ન થાય એવી ભાવદશા જન્મે (દા.ત. સ્ત્રી એક
વાર પતિનો ભાવ ધારણ કરે પછી આખી જુંદગી પતિ તરીકે ગણે
છે.) એ પછી સત્યની અભિલાષા આવી ભાવદશા વાળા હૃદયમાં
જન્મે એ અભિલાષા જ સત્યની પ્રાપ્તિનું સાધન છે.

સત્યનાં અધિકારી કોણા ?

જેને સંસાર રાજુ કરવા અસમર્થ છે, અર્થાત જેને ભોગમાં
રોગ, હર્ષમાં શોક, સંચોગમાં વિયોગ, સુખમાં દુઃખ, ધરમાં વન
અને જીવનમાં મૃત્યુનો અનુભવ થાય છે, તે જ સત્યનાં અધિકારી
છે.

જેને યોગ અને ભોગ એકેય શાંતિ ન દઈ શકે એ
સત્યનાં અધિકારી છે.



માનને ખાતર ધનનો ત્યાગ કરવો સરળ છે પણ વ્યર્થ છે.

-મોહને ખાતર ધન અને માનનો ત્યાગ કરવો સરળ છે પણ વ્યર્થ છે.

લોભને ખાતર ધન, માન, અને મોહનો ત્યાં કરવો સરળ પણ
વ્યર્� છે.



એવી એક પણ વસ્તુ નથી જેની પ્રાપ્તિ આપમેળે
અપ્રાપ્તિમાં ન ફેરવાઈ જાય.

એવી કોઈ અશુદ્ધિ છે જ નહી જે આપ મેળે ન મટી જાય.

એવું એકપણ સુખ નથી જે એની મેળે ન વિખરાય જાય.



સંકલ્પ પ્રમાણે ન થાય ત્યારે જે દુઃખ થાય એ વેળા સુખની

આશા ન રાખીએ તો એ દુઃખ સાધકની જળતા તોળે છે.



અગર કોઈ કારણાસર સેવા ન કરવી હોય તો, એવાઓએ
માની લીધેલા બધા સંબંધોનો વિવેકપૂર્વક અંત કરવો અનિવાર્ય
છે. સેવાની રૂચી ન હોય અથવા તો સેવાનું સામર્થ્ય ન હોય તો
પણ સંબંધ રાજવો એ સાધનામાં વિદ્ધિશ્રીપ અને સંસારમાં દુઃખ
શ્રીપ છે



પ્રેમ એ સંબંધ નથી - સદ્ગુરૂ ભાવ છે. જ્ઞાન પ્રેમમાં જ પ્રગટે

છે. જ્યાં પ્રેમ નથી ત્યાં અજ્ઞાન છે. આનં દમય કોશમાં પ્રેમ નિત્ય શુદ્ધ હોય છે. વિજ્ઞાનમય કોશમાં પ્રેમનાં દર્શન થાય છે. મનોમય કોશમાં પ્રેમનો ભોગ અને પ્રેમનું અલિમાન રહે છે.

જ્યાં સુધી પ્રેમનાં અભાવમાં માણસ અશાંત છે ત્યાં સુધી જ પરમાત્માને ગોતે છે. પ્રેમ પ્રગટતા બધે પરમાત્મા દેખાય છે. પ્રેમ કામથી ઢંકાય જતા બધે પદાર્થ દેખાય છે.

સાભાજ્ય છોડવું સરળ છે, પણ પ્રેમ ખાતર જ્ઞાનનો અહુંકાર છોડવો કઠળા છે. ઓમાંચ તામસીક જ્ઞાન છોડવું દુર્લભ છે.



જે સ્વયંથી સંસારબાજુ ચાલે છે એને પ્રથમ થોડું સુખ
અને પછી પારાવાર દુઃખ મળે છે.

જે સંસારથી સ્વયં તરફ ચાલે છે એને પ્રથમ દુઃખાભાસ અને પછી
આનંદ મળે છે.

કર્મ યોગ દ્વારા મમતા મટે છે અને જ્ઞાનયોગ દ્વારા અહંકુર
મટે છે.

સામાન્યતા: આઠપ્રકારનાં દાન છે:
અભયદાન, માનદાન, ધનદાન, કન્યાદાન, પિંડાદાન,

ભૂમિદાન, વસ્તુદાન અને વિચારદાન.

અન્નદાનને મહાદાન ગણયું છે.

અન્નદાન સિવાયનાં દાન વિધિવત્તન દેવાય તો તેનું ફળ
મોળું, વિપરીત, કે અલ્પ મળે છે. જ્યારે અન્નદાનમાં વિધિની ચૂક
માફું છે.



Alms to poor makes the subtle Life rich,
which is helpful to save ourselves from gross life's
mechanicalness and help to Concurrent the past
deeds.

(Concurrent એટલે એકી સાથે ભોગવવું. દા.ત. જુદા-જુદા કર્માની સજા એક વરસ, બે વરસ, અને ત્રણ વરસ થઈ હોય એ એક સાથે ભોગવી લેવાની પરવાનગી મળે તો બધી સજા છ વરસ ને બદલે ત્રણ વરસમાં પૂરી થાય એને સજા Concurrent થઈ કહેવાય.)



શ્રીમદ્ રાજચંદ્રે લખ્યુ છે:

ત્રણ જણા સુખ નથી ઈરછતા-

(૧) નાસ્તિક (૨) જડ (૩) સિદ્ધ

શ્રીમદ્ નું જ વાક્ય છે : દ્રષ્ટિમાંથી વિષ ગયા પણી ગમે તે

માણસ, ગમે તે સ્થળ, ગમે તેવા વચન, ગમે તેવા કથન, ગમે તે
તર્ક.....

પ્રાયઃ અહિતનું કારણ થતા નથી.



શ્રીમદ્ લખે છે :

ધણાં ધણા પ્રકારથી મનન કરતાં અમારો દંષ્ટ નિશ્ચય છે કે
ભક્તિ એ સર્વોપરી માર્ગ છે.



જે વ્યક્તિ યેરની પરંપરાને લંબાવ્યે જાય છે તે નરકમાં
પડે છે.

બે તથ્યો કટિ જઘડતા નથી. -બે કલ્પના જઘડે છે ખરી.



કામવાસના થી મોટો રોગ નથી. મોહથી મોટો કોઈ શત્રુ નથી. કોઇથી મોટી કોઈ આગ નથી. બ્રહ્મચર્યથી મોટી કોઈ દવા નથી. ધેરાગ્ય થી મોટો કોઈ મિત્ર નથી. અજોદથી વધુ કાંઈ શીતળ નથી.



ભોગી શોકમન્દ હોય ત્યારે એની ભુખ મંદ પડી જાય છે. જોધ અને ચીડીયાપણાથી મંદાભિ થાય છે. ભય અને દ્રેષ્ઠથી મોઢાનો સ્વાદ બગળી જાય છે. નિરાશા - ચિંતાથી આંતરડા પર ડી.

દુષ્પ્રભાવ પડે છે. કોઈ પ્રત્યે ઘૃણા કે બદલાની ભાવનાથી

મસ્તકનાં જ્ઞાનતંતુઓમાં બગાડો જન્મે છે. અભિમાનની

અધિકતાથી લો / હાથ બી. પી. નાં ઉપ દ્રવ્ય જન્મે છે. મોહની

અધિકતાથી ગઠીયો વા, સંધિવા વગેરે વાચુનાં રોગ થાય છે.



પાપ થી ડરવુ અને જુના પાપોનો ઉદ્ય થયે શાંતિથી

ભોગવી લેવા. પૂણ્ય વાપરી ન ખાવુ અને પૂણ્યકર્મમાં આળસ ન

કરવી. આથી ભાગ્ય સુધરશે અને ભાગ્યોદ્ય થયે બ્રહ્મનીજિજ્ઞાસા

કે પરમાત્મા પ્રત્યે અનુરાગ પ્રગટશે.



What we give to the poor is what we take
with us when we die.



It is always the false that makes us suffer.



જે માતા - પિતામાં દોષ જુએ છે તે દરિક્રી, આળસુ અને
પ્રમાદી બને છે જે ગુરુમાં દોષ જુએ છે તે હલકી ચીજોમાં અટવાઈ
જાય છે. જે બાળક(નિર્દોષ) માં દોષ જુએ છે તે ઈષ્યાની આગમાં
બળે છે. જે પતિનમાં દોષ જુએ છે તે અસંતોષી બને છે. જે પતિમાં

દોષ જુએ છે તેણે શારીરિક વ્યાધી સહન કરવી પડે છે. જે
 પરમાત્મામાં દોષ જુએ છે તેની બુધ્યિ બ્રષ્ટ થાય છે. જે
 ભાઈ - ભાંડુમાં દોષ જુએ છે તે એકલતાથી પીડાય છે. જે
 સાધકમાં દોષ જુએ છે એ પશ્વાતાપની પિડામાં થી પસાર થાય
 છે. જે ભક્તમાં દોષ જુએ છે તે દ્રોહી બને છે. જે સમાજમાં દોષ
 જુએ છે તે કિંકર્તવ્ય મુઢ બને છે.



જેને મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા નથી અને સદગુરુનો
 મેળાપ થાય તો પણ એ મડદાને ઘરેણા પહેરાવવા જેવું છે
ઇસ અસાર સંસારમેં સાત વસ્તુ હૈ સાર :

સંગ, ભજન, સેવા, દયા, ધ્યાન, દૈન્ય, ઉપકાર.

દીર્ઘકાળનાં શ્રમની અપેક્ષા અલ્પતમણી કાળ પૂરતો વિશ્રાબ કંઈ
કેટલાય ગણો વધુ મહત્વનો છે.



Things are always happening in a way we
do not understand.



સાધકમાં જ્યારે શ્રદ્ધા અધિક અને પ્રંજ્ઞા મંદ હોય ત્યારે
સાધક સારહીન બાબતોમાં ધિશ્વાસ કર્યા વીના રહી શકતો નથી.

આથી ઉલદું પ્રજ્ઞા અધિક અને શ્રદ્ધા મંદ હોય તો સાધક સ્વાર્થ-
સાધુ થઈ જવાનો ભય છે.

આજ રીતે ઉત્સાહ વધુ અને સમાધિ મંદ હોય તો સાધક
બાન્તચિત્ત થવાનો ભય રહે છે અને આથી ઉલદું એટલેકે ઉત્સાહ
કમ અને સમાધિ અધિક હોય તો સાધક આળસુ-પ્રમાણી થઈ
જવાનો ભય છે.

વાસ્તવિક દુઃખોમાંથી પ્રભુ ઉગારે - કાલ્પનિક દુઃખ જાતે તજવા
પડે.

Root of Sorrow is :
claim towards the world.



યોગી આળસને લીધે યોગ-ભષ્ટ થાય છે. - ભક્ત આસક્તિને
કારણે ભક્તિ-ભષ્ટ થાય છે.



સેવા માટે સૌ કોઈ આપણા છે; પોતાના સુખભોગ માટે આવડા
મોટા સંસારમાં કોઈ પણ આપણું નથી.



उत्तम अहैतु की भक्ति : मध्यमा ध्यान-धारणा : ८

अधमो कर्म-सन्यास : तकँ-चचों अधमाधमा : ९



प्राकृतिक नियम छे के आपणाने जे कांઈ शक्ति भणी छे ते
अशक्तिमान नी मालिकीनी छे !!



सुख दुःख माने हुअे है - संत्य नहीं है।

संसार के संबंध माने हुअे है - सत्य नहीं है।

परमात्मासे दुरी मानी हुई है - सत्य नहीं है।

લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસનાને લીધેજ

યથાર્થ આત્મજ્ઞાન થતું નથી.

— ◊ —
અચાહમેં શાંતિ ।

અસંગતામેં ભૂક્ષિત ।

અભિનૃતામેં ભર્કિત ।

જ્યારે તમારી પાસે તમારું કાંઈ નહીં રહે ત્યારે તમને કાંઈ

જ દુઃખ નહીં રહે.

— ◊ —
સદગુરુ તમને એક જ ક્ષણામાં જગાડી દ્યો !!.... પણ તમને

જ શું કામ જગાડે એનો સંતોષકારક જવાબ તમારે આપવો પડે !!!

પરમાત્મા અભી હૈ, થઈ હૈ, અહંમય હૈ ।

જે નિરંતર હૈ, ઉસે પાને કા કોઈ માર્ગ નથી ।

sin against God is one thing, but Sinning
against man is worse.

Effort is not effort without right time, right
place and right people.

Do not speak of your heart-ache - for God is
speaking. Do not seek him - for "He" is seeking.

A man with real power appears powerless.



Your business is to love God.

The rest is "His" business.




આ વિશાળ દુનિયામાં પ્રભુ સિવાય મારું કોઈ નથી, અને હું પ્રભુ
સિવાય કોઈનો નથી - એટલો જેને બોધ સેટૈવ રહેતે જ્ઞાની ભક્ત
પરમાત્માને સૌથી વધુ પ્રિય છે.



તુમ્હે જો પકડે હો વહ અવિના શી હૈ ।

જુસે તુમ પકડે હો વહ વિના શી હૈ ।

A Person who seeks the truth must also tell
the truth.



જીવને આઠ પાશ છે. ક્રિષ્ટ પરથી આ આઠ પાશ છુટે તો
ઈશ્વર દર્શન થાય :

- (૧) લજ્જા (શરમ-સંકોચ), (૨) ઘૃણા , (૩) ભર્ય (ભવિષ્યનો)
- (૪) જાતિ (સ્ત્રી / પુરુષ), (૫) કૂળ (બ્રાહ્મણ - ક્ષત્રિય ઇ-)
- (૬) શીલ (આભઢ), (૭) શોક (વિટેલાનો),
- (૮) છુપાવવાની ઈચ્છા.



જગત ટી.વી જેવુ છે : દેખાળો છે ઘરણું પણ દેતું થી કાંઈ નથી.

અપમાનથી તપમાં વૃદ્ધિ અને સંભાનથી તપનો ક્ષય થાય છે.

તબ લો જોગી જગતગુરુ જબ લો રહે નિરાશ
જબ આશા પીછે લગી -જગ ગુરુ જોગી દાસ.

રણ વન વ્યાધિ વિપત્તિ મેં વૃથા ડરો ભત કોચ
જો રક્ષક જનની જઠર સો હરિ ગયો ન સોચ.

કામ બીગાડે ભક્તોકો, જ્ઞાન બીગાડે ઝોઘ
લોભ વિરાગ બીગાડ્યે, મોહ બીગાડે બોઘ

દુંભી - દ્રોહી - સ્વાથ ૧૦ - વાદી - માની પાંચ

યે ખલ નાહી સહી શકે - પ્રેમ અભિ કી આંચ

જારાયણ સંસારમેં ભુપતિ ભયે અનેક

મૈ મેરી કર મર ગયે, લે ન ગયે તૃણ એક

પ્રેમ બરાબર યોગ ના, પ્રેમ બરાબર ધ્યાન

પ્રેમ બિના ચણ - યોગ - જપ સાધન થોથે જાન

કબીરા સુમીરન સાર હૈ ઓર સકલ જંજાલ
આદિ મધ્ય અંત સુમીરના બાકી હૈ બમજાલ

— • — ■ —
દાદુ કરતા હમ નહી - કરતા હૈ ઓર કોચ
કરતા હૈ સો કરેગા - તુ મત કરતા હોચ

— • — ■ —
જો જાકી શરણો તકે તાકો તાકી લાજ
જલ મછરી સુધી ચેઢે, બહયો જાત ગજરાજ

— • — ■ —
જુઠે સુખકો સુખ કહે માનત હૈ મન મોટ
જગત ચબેના કાલકા કછુ મુખમેં કછુ ગોટ

नीय नीय सब तरी गये संत चरन लपतीन

जाति ही के अभिमान ते दुबे बहुत कुलीन



सेवा करे धरमको पाले धरमे रहे उदासी

अपना सा दुःख सबका जाने ताहि मीले अविनाशी



नहाये धोये कचा हुआ, जो मन मेल न जाये

मीन सदा जलमें रहे - तबहुं गदं बसाये.



चाखा चाहे प्रेमरस स राखा चाहे मान

एक झ्यानमें दो खडग टेखी सुनी न कान.

જહી આપ તહી આપદા, જહી સંશય તહી સોગ,
આપા તજે ઓર હરિ ભજે, કાટે જમકા રોગ.



સત્ય વચન ઓર દીનતા, પરસ્ત્રી માત સમાન,
ઇતને સે હરિ ના મીલે તો તુલસીદાસ જમાન.



રામ નામ સલ કોઈ કહે ઠગ, ઠાકોર ઓર ચોર,
બિના પ્રેમ રીઝે નહીં - તુલસી નંદ કિશોર.



તુલસી તલપ ન છોડીયે, નિશ્ચે લીજે નામ
મનુષ મજુરી એત હૈ - કચું રાખેગા રામ.



ਦੁਰੀਆ ਦੁਜੇ ਧਰਮਿਕੇ ਸੰਸਾਰ ਮਹਿਨ ਤੂਲ
ਰਾਮ ਨਾਮ ਰਟਤਾ ਰਹੈ - ਸਰਵ ਧਰਮਕਾ ਮੁਲ.



ਕਬੀਰਾ ਮਨ ਤੋ ਏਕ ਹੈ ਭਾਵੇ ਤਹਿੰ ਲਗਾਅਥ
ਚਾਹੇ ਹਰਿ ਕੀ ਭਕਿਤ ਪਰ, ਚਾਹੇ ਵਿਖਾਅ ਕਖਾਅ.



ਕਬੀਰਾ ਆਪ ਠਗਾਈਅ ਓਰ ਨ ਠਗੀਅ ਕੋਥ
ਆਪ ਠਗਾਅ ਸੁਖ ਉਪਯੈ, ਓਰ ਠਗੇ ਦੁ:ਖ ਹੋਥ



ਆਂਖ ਕਾਨ ਮੁਖ ਢਾਂਪਿਕੈ ਨਾਮ ਨਿਰੰਜਨ ਲੇਥ
ਬਿਤਰ ਕੇ ਪਟ ਤਬ ਖੁਲੈ, ਜਬ ਬਾਹਰ ਕੇ ਪਟ ਫੇਥ

जो याहो हरि - भी किंतु को, तजे विषय-रस पान

एक साथ रहे नहीं - भोग और भगवान्

नारायण बीन बोधके पंडित पशु समान

ताते अति मुराख भलो, जो सुभिरै भगवान्.

प्रेम छुडाये जगतको प्रेम भीलाये राम

प्रेम करे गति ओर ही, से पहुँचे हरिद्याम.

गायु

— ● — ■ — ● —

आयु धन-विद्या - गुन-बल, जाका हरि सो हेत.

दो

खट न बड़पन देत, नारायण सोईबडा, जाका हरि से हेत

સુંદર ટેહી ટેઝિકે ઉપજત હૈ અનુરાગ

મઢી ન હોતી ચામકી તો જીવત ખાતે કાગ

યથાર્થ આર્ત ભક્તિ બાણ જ આત્મા - સાક્ષાતકાર થાય છે.

આપણે કાંઈ હૃદિન થાય એના દુઃખ કરતાં,

આપણે કોઇને હાનિ પહોંચાડીએ એ દુઃખ - આપણને વધુ સાલે,

ત્યારે આપણે યથાર્થ કલ્યાણ માર્ગે છીએ.



મોટાની સેવા એમની આજ્ઞા પ્રમાણે અને નાનાની સેવા આપણા

વિચાર પ્રમાણે કરવી. સેવા કોણી કરવી એનો નિર્ણય ગુરુ અથવા

શાસ્ત્ર દ્વારા કરવો.



જ્યાં સુધી દોષ છે, ત્યાં સુધી દુઃખ પણ રહેવાના.

સાધકે નીચેના - ૨૮ દોષોથી બચવું :-

- | | | | |
|----------------------|---------------------------------|-----------------|---------|
| (૧) લોભ | (૨) મોહ | (૩) અભિમાન | (૪) કામ |
| (૫) ક્ષેધ | (૬) ઈર્ષા | (૭) રાગ - ક્લેષ | (૮) આળસ |
| (૯) અનિયમિત નિંદા | (૧૦) અધિક ભોજન | | |
| (૧૧) ઉંમાઈ પ્રવૃત્તિ | (૧૨) પ્રપંચી સ્વભાવ | | |
| (૧૩) અનિયમિત કાર્ય | (૧૪) વિલાસીપણું | | |
| (૧૫) માનનું સુખ | (૧૬) અમર્યાદિત કામના | | |
| (૧૭) પોતાની મોટાઈ | (૧૮) તુચ્છ વસ્તુઓમાં સુખ માનવું | | |

(૧૯) રસાસ્વાદ (૨૦) અતિભોગ (૨૧) બીજાનું બુરું

ઇચ્છાખું (૨૨) અકારણ સંચય (૨૩) અનેકથી પ્રીતિ (૨૪)

અયોગ્ય સ્થળે નિવાસ (૨૫) નિયમ પાલનમાં શીથીલતા.



ઉપરનાં દોષમાંથી કોઈ પણ દોષ હશે તો તે મનને ચંચલ બનાવ્યા

કરશો, અને, આથી સાધનામાં વિદ્ધન આવ્યા કરશો.



